



February 06, 2025

To, National Stock Exchange of India Limited Symbol – Symphony To, **BSE Limited** Security Code – 517385

Sub.: Submission of newspaper clippings of publication of financial results

Dear Sir / Madam,

We are submitting herewith newspaper clippings of unaudited financial results for the nine months/ quarter ended on December 31, 2024, published on February 6, 2024.

Please take the same on your record and kindly acknowledge the receipt.

Thanking you,

Yours Truly, For, Symphony Limited

Mayur Barvadiya Company Secretary and Head - Legal

Encl.: as above

TAKE TWO 19



BARREL OF TROUBLE

Trump's tariffs on his major trading partners and India's 2025-26 Budget jeopardise the country's growing demand


for fuel and put oil company finances under strain

S DINAKAR Amritsar, 5 February


ndia's state-owned oil-marketing companies (OMCs) are staring down an abyss in 2025 on the heels of a disappointing annual budget for oil and gas for 2025-26 and from the volatility in oil and gas markets caused by the Trump administration's disruptive energy tariff policies. These developments come amid discounted Russian oil flows, a mainstay of gross refining margins for Indian refiners, slowing to a trickle in the face of the latest US sanctions and expensive alternative supplies.

US President Donald Trump initially threatened tariffs as high as 60 per cent on China and 25 per cent on Mexico and Canada, subsequently reducing rates to 10 per cent for Chinese imports and for energy imports from Canada and Mexico. The changes were effective from Tuesday but have been delayed by at least a month for its North American trading partners.

Trump's tariffs have roiled oil markets over concerns of potential near-term supply disruptions. After an initial spurt, gains on crude oil prices more than halved on the news that some tariffs might be delayed. European benchmark Brent futures now at \$76 per barrel, after closing at around \$82 per barrel on January 15, reflecting the volatility from Trump's policy announcements. Trump on Tuesday ordered reinstating a "maximum pressure" campaign on Iran, which had last year illegally exported around 1.7 million barrels per day (bpd) of oil, primarily to China. In response to the news that Trump would sign the order, benchmark crude oil prices spiked nearly \$2 per barrel, UK market intelligence provider Energy Intelligence reported. China, in turn, has slapped retaliatory tariffs of 15 per cent on US liquefied natural gas (LNG) and 10 per cent on imports of US crude oil. Prices of European gas benchmark TTF, a reference point for spot LNG rates, have increased by more than 30 per cent since December to a 15-month high of over \$16 per million British thermal units, said Greg Molnár, gas analyst at the International Energy Agency, in a LinkedIn post.



Source: Company/industry data



threaten to take more than 1 million bpd of crude oil out of the market — around a fifth of India's oil demand. And with Saudi Arabia-led Organization of the Petroleum Exporting Countries (Opec) oil grouping reportedly comfortable with oil prices of \$80 per barrel, it may be reluctant to compensate for the losses of Iranian barrels with Opec barrels.

"LPG is a substantial drag on the profitability of OMCs," Vasisht said. ubsidies provided for direct benefit transfer of ₹1,500 crore, and the ₹9,100 crore allocated for the Ujjwala LPG scheme for 2025-26 are inadequate, he added. OMCs are expected to post under-recoveries of ₹40,000 crore on LPG sales by the end of this financial year, analysts estimate. Indian Oil's earnings (April-December), after adjusting for LPG under-recoveries, would have been ₹19,000 crore/₹20,000 crore and not ₹5,500 crore, said Smartsun Capital's Sumeet Rohra, a fund manager, in the company's latest quarterly earnings call, according to the transcript, Rohra said that the company had lost a staggering ₹95,000 crore in market cap, and the current market cap is just a third of its assets of ₹4,85,000 crore. Indian Oil Director of Finance Anui Jain replied that "the government is fully seized of this matter and is definitely going to support OMCs". Oil minister Hardeep Singh Puri also suggested some form of compensation to OMCs during a press briefing in Mumbai last month. But the government has made no provision in the 2025-26 Budget, presented to Parliament on February 1, to compensate state-run refiners for losses incurred in selling domestic LPG to households at below cost. Fuel prices were unchanged last year because of important state and Lok Sabha elections.







for the Quarter and Nine months ended December 31, 2024

(₹ in Crores except earnings per share)								
	Quarte	r ended	Nine mon	Year ended				
Particulars	December 31, 2024	December 31, 2023	December 31, 2024	December 31, 2023	March 31, 2024			
	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited			
Total Income from Operations	1,686.03	1,492.75	5,004.12	4,577.40	6,097.18			
Net Profit for the period								
(before Tax, Exceptional and/or Extraordinary items)	487.59	422.16	1,404.24	1,228.07	1,617.75			
Net Profit for the period before tax								
(after Exceptional and/or Extraordinary items)	487.59	422.16	1,404.24	1,228.07	1,617.75			
Net Profit for the period after tax								
(after Exceptional and/or Extraordinary items)	360.78	310.98	1,047.40	914.16	1,201.22			
Total Comprehensive Income for the period								
[comprising Profit for the period (after tax) and								
Other Comprehensive Income (after tax)]	360.79	311.89	1,047.42	916.88	1,201.24			
Equity Share Capital	21.25	21.25	21.25	21.25	21.25			
Reserves (excluding Revaluation Reserve)								
as shown in the Audited Balance sheet of								
previous year	-	-	-	-	3,677.64			
Earnings Per Share ₹ (Face value of ₹ 10/- each)								
(not annualised except for the year ended March)								
Basic :	169.78	146.34	492.89	430.19	565.28			
Diluted :	169.78	146.34	492.89	430.19	565.28			
	Total Income from Operations Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items) Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary items) Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items) Total Comprehensive Income for the period [comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)] Equity Share Capital Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance sheet of previous year Earnings Per Share ₹ (Face value of ₹ 10/- each) (not annualised except for the year ended March) Basic :	ParticularsDecember 31, 2024Total Income from Operations1,686.03Net Profit for the period1,686.03(before Tax, Exceptional and/or Extraordinary items)487.59Net Profit for the period before tax487.59(after Exceptional and/or Extraordinary items)487.59Net Profit for the period after tax487.59(after Exceptional and/or Extraordinary items)360.78Total Comprehensive Income for the period360.78Total Comprehensive Income (after tax) and360.79Equity Share Capital21.25Reserves (excluding Revaluation Reserve)360.79as shown in the Audited Balance sheet of previous year-Earnings Per Share ₹ (Face value of ₹ 10/- each) (not annualised except for the year ended March)169.78	Particulars20242023UnauditedUnauditedTotal Income from Operations1,686.031,492.75Net Profit for the period11(before Tax, Exceptional and/or Extraordinary items)487.59422.16Net Profit for the period before tax487.59422.16(after Exceptional and/or Extraordinary items)487.59422.16Net Profit for the period after tax360.78310.98(after Exceptional and/or Extraordinary items)360.78311.89Total Comprehensive Income for the period21.2521.25Reserves (excluding Revaluation Reserve)360.79311.89Equity Share Capital21.2521.25Reserves (excluding Revaluation Reserve)as shown in the Audited Balance sheet ofprevious yearEarnings Per Share ₹ (Face value of ₹ 10/- each)169.78146.34(not annualised except for the year ended March)169.78146.34	Quarter endedNine monParticularsDecember 31, 2024December 31, 2023December 31, 2024Total Income from Operations1,686.031,492.755,004.12Net Profit for the period1,686.031,492.755,004.12(before Tax, Exceptional and/or Extraordinary items)487.59422.161,404.24Net Profit for the period before tax487.59422.161,404.24(after Exceptional and/or Extraordinary items)487.59422.161,404.24Net Profit for the period after tax360.78310.981,047.40(after Exceptional and/or Extraordinary items)360.79311.891,047.40Total Comprehensive Income for the period360.79311.891,047.42[comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]360.79311.891,047.42Equity Share Capital21.2521.2521.2521.25Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance sheet of previous year	Quarter endedNine mortParticularsQuarterQuarterNine mortendedDecember 31, 202420232024202320242023UnauditedUnauditedUnauditedUnauditedUnauditedTotal Income from Operations1,686.031,492.755,004.124,577.40Net Profit for the period487.59422.161,404.241,228.07(after Exceptional and/or Extraordinary items)487.59422.161,404.241,228.07Net Profit for the period after tax487.59422.161,404.241,228.07(after Exceptional and/or Extraordinary items)360.78310.981,047.40914.16Total Comprehensive Income for the period360.79311.891,047.42916.88Equity Share Capital21.2521.2521.2521.25Reserves (excluding Revaluation Reserve)360.79311.891,047.42916.88as shown in the Audited Balance sheet of			

Note : The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results is available on the Stock Exchange website at www.bseindia.com and on the Company's website at www.abbott.co.in. The same can be accessed by scanning the QR code provided below



Abbott

For and on behalf of the Board of Directors of **Abbott India Limited**

SWATI DALAL **Managing Director** DIN: 01513751


Place : Mumba Date : February 5, 2025 Symphony **GROWTH IS NATURAL** SYMPHONY LIMITED (₹ in Crores) Extract of Unaudited Consolidated Financial Results for the Quarter and Nine Months ended cember 31, 20 Quarter Nine Months Quarter vine Months Consolidate Ended Ended Ended Ended 9M YoY Particulars Growth (%) 31-Dec-24 31-Dec-24 31-Dec-23 31-Dec-23 (Unaudited) (Unaudited) (Unaudited) (Unaudited) Revenue Revenue from operations 242 1,088 247 824 EBITDA (Excluding Other Income, Exceptional Items and Foreign 42 35 211 113 +32% Exchange & MTM Loss)

Volatile markets

Volatile oil prices impact India's fiscal position and oil company finances, and a sharp rise in LNG prices threatens to unravel India's projected 12 per cent growth in demand for the fuel this fiscal. While traders may embrace volatility, state-run refiners and Indian policymakers prefer price stability because they are devoid of instruments to hedge volatility at the pump by passing on rate changes to consumers.

"Certainly it helps to have a more stable pricing regime," said Prashant Vasisht, senior vice-president and co-group head, corporate ratings, at Icra, a US Moody's affiliate. "Overall, it could impact their marketing margins because auto fuel levels are static. Higher prices eat away marketing margins."

There have been concerns of run cuts by Indian refiners, but supply availability from other crude oil suppliers does not seem to be an issue for now, said Singapore-based consultancy Facts Global Energy in a report. "Of course, this does impact margins." The country's crude oil basket averaged \$82.5 per barrel as of January 21, a sharp rise from \$73.3 per bbl in December 2024, it said. The February average is at \$78.4 per bbl,



according to the oil ministry data.

The finances of oil-marketing companies rest on a Trishul, an industry source explained. The three prongs of profitability are gross refining margins, or what a refiner makes turning crude oil into fuels; marketing margins, or what Indian Oil or Bharat Petroleum earn from selling petrol and diesel at pumps; and liquefied petroleum gas (LPG) margins. At the moment all three look challenged.

Singapore GRMs, a benchmark for Indian margins, ranged from an anaemic 30 cents to \$3 per barrel in the last two weeks. The GRMs remain weak. a Mumbai-based senior analyst said. Margins have more than halved for state-run refiners in the just concluded December quarter from a year earlier, the company data shows.

Marketing margins also seem inadequate to cover low profits from refining. Marketing margins have more than doubled from as low as ₹2.60 per litre late last month, when crude oil was over \$80 per barrel, to ₹6 per litre at \$76.4 per barrel crude, but the sensitivity to crude oil prices is high, and the current volatility impacts profits at the pump.

LPG drag

Marketing margins at 35 per litre are "marginally above average," the analyst said. Typically, in the past, oil-marketing companies would use the swings in marketing margins to compensate for losses incurred from fixed prices of petrol and diesel. LPG under-recoveries were compensated as seen in the ₹22,000 crore provided to oil marketing companies by the government in 2022-23.

That support is no longer available. Marketing margins on petrol and diesel need to be around ₹8 per litre to compensate for losses incurred on LPG, another analyst said. That would require crude oil at \$70 per barrel levels on a sustained basis, something unlikely given the current turmoil in oil markets from Trump's energy policies. The US President's actions against Iran

Sanction woes

Adding to refiners' woes is the likelihood of erosion in discounted crude oil from Russia for the next few months. A shortfall in February will be minor, but state-run refiners expect a larger supply gap in March. There may be interruptions in flows in April and uncertainty further down.

Facts Global estimated that 450,000 bpd of Russian crude oil exports to India were at risk following the January 10 sanctions by the US. Others estimate it at 600,000 bpd. State-run refiners have issued tenders for over 15 million barrels of crude oil for deliveries in March and April, with some of the barrels changing hands at a \$4-5 per barrel premium over the Dubai benchmark that compares to premiums of \$1-1.5 per barrel prior to sanctions, increasing crude oil sourcing costs for refiners, and further impacting profitability.

Profit before Exceptional items and Tax	28	216	50	125			
Exceptional items (Refer note no. 2)	46	46	-	2			
Profit/(Loss) after Exceptional items and before Tax	(18)	170	50	123			
Net Profit/(Loss) after Tax for the period/year	(10)	134	41	100			
Total Comprehensive Income for the period/year [Comprising Profit for the period/year (after tax) and Other Comprehensive Income (after tax)]		135	41	100			
Paid-up Equity Share Capital (Face Value ₹ 2/- per share)	14	14	14	14	PAT		
Earnings Per Share (of ₹ 2/- each)*					+34%		
Basic & Diluted (₹)	(1.37)	19.50	5.91	14.41			
* EPC is not annualized for the supertax/size months and ad December 21, 2021 and December 21, 2022							

* EPS is not annualised for the quarter/nine months ended December 31, 2024 and December 31, 2023 NOTES:

1. Key numbers of Standalone Results are as under:				(₹ in Crores)			
Particular.	Quarter Ended	Nine Months Ended	Quarter Ended	Nine Months Ended	Standalone 9M YoY		
Particulars	31-Dec-24	31-Dec-24	31-Dec-23	31-Dec-23	Growth (%)		
	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)			
Revenue from operations	182	814	177	545	Revenue		
EBITDA (Excluding Other Income, Exceptional Items and Foreign Exchange & MTM Loss)	34	188	41	98	+49%		
Profit before exceptional items and tax	39	220	52	134			
Exceptional items (Refer note no. 3)	46	46	-	-			
Profit/(Loss) after Exceptional items and before Tax	(7)	174	52	134			
Net Profit/(Loss) after Tax for the period/year	(4)	132	43	107			

2. During the quarter ended December 31, 2024, the Parent Company has made a provision for doubtful debts amounting to ₹ 45.99 crores classified, as an exceptional item. This provision is in addition to the provisions made in earlier periods and pertains to receivables from M/s Pathways Retail Pvt Ltd, Delhi (E-Com distributor). As on December 31, 2024, the entire outstanding amount from the said distributor has been provided for as doubtful debt by the Parent Company

The Parent Company has initiated stringent legal actions under sections 336, 340, 316, 318, 61 & 54 of the Bharatiya Nyaya Sanhita Act, 2023, as well as under section 138 of the Negotiable Instruments Act, 1881, for the dishonouring of a cheque.

Furthermore, the Parent Company has entered into a settlement agreement with the said distributor, executed to secure repayment in accordance with court proceedings. The Parent Company has created rights and interests over valuable immovable properties located in Gurugram and Delhi. The residual value of these properties is expected to adequately cover the outstanding dues.

3. The Board of Directors in their meeting held on February 05, 2025 declared 3rd interim dividend of ₹ 2/- (100%) per equity +23% share of ₹ 2/- each amounting to ₹ 13.73 crores. The record date for the payment of interim dividend is February 11, 2025.

4. The above is an extract of detailed format of quarterly/nine months ended Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015. The full format of the quarterly/nine months ended Financial Results are available on the Stock Exchange websites www.nseindia.com. www bseindia.com and on Company's website www.symphonylimited.com. The same can be accessed by scanning the QR code provided below



27°C world

Place : Ahmedabad

Date : February 05, 2025

By Order Of The Board For Symphony Limited

Achal Bakeri Chairman & Managing Director DIN-00397573



PAT

for la Leader in Air Cooling Solutions for Residential, Commercial, and Industrial Spaces, Trusted in Over 60 Countries Worldwide, Now Offering Advanced Tower Fans and Gevsers Registered Office: Symphony Limited, Symphony House, FP-12 TP-50, Bodakdev, Off SG Highway, Ahmedabad 380059, Gujarat. India. CIN: L32201GJ1988PLC010331 | Web: www.symphonylimited.com | Email: corporate@symphonylimited.com | Phone: +91-79-66211111 | Fax: +91-79-66211139

OUR GLOBAL BRANDAS MONIQUE DIETSO TOUCH CLOUD SILVER STORM DIET /KOOL WINTER SUMD JUMBD DUEJ, Archic Circle /Master Cool SPA SAUNA SOUL HI GELAND BONAIRE



THURSDAY • 6-2-2025 **03**

બીજા દિવસે મંગળવારે મહાકુંભ

Year Ended

31.03.2024

Audited

4797.47

32.10

54.39

54.39

24.34

24.34

742.03

(31.42)

(0.33)

(0.33)

ધ્વજ ઉતારી લીધો હતો.

[Rs.In Lakhs except per share detail]

31.12.2023

Unaudited

3576.76

23.93

(30.00)

(30.00)

(30.00)

(30.00)

742.03

(85.76)

(0.40)

(0.40)

Nine Months Ended

31.12.2024

Unaudited

3787.08

22.11

242.20

242.20

242.20

241.26

742.03

209.84

3.25

3.25

JAI HIND-AHMEDABAD

મહાકુંભમાં અમૃતસ્નાન બાદ અખાડાઓનું પ્રસ્થાનઃ કાશી અને અયોધ્યા ધામમાં પડાવ પંચાયતી અખાડા નિર્મલે

ફેબ્રુઆરીએ ફરકાવવામાં આવશે કિડગંજમાં પડાવ નાખશે.તે પછી મુખ્યાલય કિડગંજમાં છે. અને ૭ ફેબ્રુઆરીએ મોટા પોતાના મૂળ વતન હરિદ્વાર જવા મકરસંક્રાંતિ, મૌની અમાવસ્યા વસંત પંચમીના અમૃત સ્નાનના અખાડાનો ધ્વજ ફરકાવવામાં રવાના થશે. બડે ઉદાસીન અને વસંત પંચમી અમૃત સ્નાન આવશે. બડે ઉદાસીનના ધર્મગુરુ અખાડાના મહંત દુર્ગાદાસે પછી ત્યાં હાજરી આપવાની નગરમાં સ્થાપિત તેનો ધાર્મિક થોડા દિવસો માટે પ્રયાગરાજના જણાવ્યું કે તેમના અખાડાનું ^{પરંપરા} છે.

Sr.

No.

Income

b) Other income

તૈયારીઓ ચાલી રહી છે, પરંત ૧૫ કેબ્રઆરીએ તેમનો અખાડો

બાદ અખાડાઓએ પ્રસ્થાન વિશ્વનાથના શહેરમાં પડાવ નમાવશે. ઉદાસી અને નિર્મળ પંચાયતી નિરંજની અખાડાએ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી નાખવાની તૈયારી કરી રહ્યા છે, અખાડાઓએ ભગવાન વિષ્ણના કાશી જવાનું આયોજન કર્ય છે. છે. એક અખાડાનો ધાર્મિક ધ્વજ તો કેટલાક ત્યાં ભોલેનાથ સાથે નિવાસસ્થાન હરિદ્વાર જશે અને અખાડાના કિશોર ગિરીના ઉતારી લેવામાં આવ્યો છે, હોળી મનાવવાની તૈયારી કરી રહ્યા મહાકું ભમાં તેમના રોકાણથી જણાવ્યા અનુસાર, મહાકુંભ પછી મેળવેલ પુણ્ય લોકો સુધી સાતેયશૈવ અખાડા કાશીમાં ભેગા વૈષ્ણવ અનુયાયીઓ પહોંચાડશે. પંચનામ આવાહન થશે અને સનાતનના વિકાસ માટે અખાડામાં પ્રસ્થાન માટેની સંપૂર્ણ આગળની યોજનાઓ બનાવશે.

રાજ , તા.૫ આવ્યો છે. શૈય અખાડાના ધાર્મિક અયોધ્યાના અખાડાઓમાં જશે આખો અખાડો વઘમાં વધુ બે-વસંત પંચમી અમૃત સ્નાન નેતાઓ મહાશિવરાત્રી સુધી બાબા અને રામ લહ્યાના ચરણોમાં માથું ત્રણ દિવસમાં કાશી પહોંચી જશે.

> વૈષ્ણવ અનુયાયીઓ અખાડા અયોધ્યા જશે અને રામલલ્લાના ચરણોમાં માથું નમાવશે

આગામી દિવસોમાં વધી જશે. કોફી તો વિશ્વભરમાં મોંઘી થઈ રહી છે અને તેના ભાવમાં ૭૫%નો વધારો થયો છે જેથી દનિયાભરની કોકી આગળ વધશે. બ્રાન્ડના ભાવમાં વધારો થયો છે


પેકીંગના ભાવ વધારવા તૈયારી ભારતના ઘર ઘર સુધી પહોંચી ગયેલી મેગી અને લિજજતદાર નેસ્લે કોફી સહિતની બ્રાન્ડના ભાવ કોફીનો ભાવ દુનિયામાં ૭૫% જેટલો વધ્યો

કેટલાકની ભમિકા બનવા લાગી છે. છે.

પ્રસ્થાન માટે શુભ મુહુર્ત જોવામાં

જે નેસ્લેને પણ લાગુ પડે છે. નેસ્લેના ચેરમેન સુરેશ નારાયણે જણાવ્યું કે ખાદ્ય ફગાવો સતત વધતો જાય છે જે ગ્રાહકોને અસર કરે છે અને લોકોની ખરીદી ઘટી છે. નેસ્લે તેની અન્ય બ્રાન્ડ કિટકેટ ચોકલેટ-સેલેલકના ભાવ પણ વધારશે. તેઓએ બજેટની પ્રશંસા કરતા કહ્યું કે અનેક બજેટ જોગવાઈએ દેશના મધ્યમ વર્ગની ચિંતાને ઓછી કરવા પ્રયાસ કરે છે. તેઓએ સ્વીકાર્યુ કે હવે કોઈ બ્રાન્ડ આખા ભારતમાં છવાઈ જાય તે દિવસો પુરા થયા. પ્રાદેશિક બ્રાન્ડ પણ મજબૂત બની રહી છે અને તેથી કંપનીઓ માટે તેની વ્યૂહરચના બદલવી પડે છે.

કોફી-ચોકલેટ-મેગી સહિતના



વૈષ્ણવ પરંપરાના નિર્મોહી દાસ અયોધ્યા જવાના પોતાના

અવધેશ પુરીએ જણાવ્યું કે તેમનો ધ્વજ બુધવારે એટલે કે પ

આવશે અને યાત્રા કાશી વિશ્વનાથ મોટા ઉદાસીન અખાડાના ધ્વજ દરબારમાં જયજયકાર સાથે નીચે ઉતારવાની તારીખ નક્કી આગળ વધશે. એ જ અખાડાના કરવામાં આવી છે. નવા અખાડાનો

Net Profit / (Loss) for the period (before Tax, 2 Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period before Tax 3 4 5

(after Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items) Total Comprehensive Income for the period [Comprising Profit /(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] Paid up Equity Share Capital

ધાર્મિક ધ્વજને નીચે ઉતારવામાં છે. નવા ઉદાસીન અખાડા અને 7

8

742.03 Reserves (excluding Revaluation Reserve) Earnings Per Share (of Rs.10/-each) (for continuing and discontinued operations) 1.36 1. Basic: 2. Diluted: 1.36 Notes:

Particulars

a) Revenue from operations (Net)

1 The above unaudited results have been reviewed by Audit Committee and approved by the Board of Directors of the Company in their meeting held on February 4, 2025. The Statutory Auditors have carried out limited review of the financial results for the guarter and nine months ended on December 31, 2024

GUJARAT TERCE LABORATORIES LIMITED

Reg. Office:- 122/2, Ravi Estate, Bileshwarpura, Chhatral, Dist. Gandhinagar (Gujarat) Phone:- 079 - 35200400, CIN NO: L24100GJ985PLC007753

email: gtll.factory@gmail.com website:www.gujaratterce.in

Quarter Ended

31.12.2023

Unaudited

1302.02

7.96

67.28

67.28

67.28

67.28

742.03

0.91

0.91

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED ON DECEMBER 31, 2024

31.12.2024

Unaudited

1268.08

6.73

97.77

97.77

97.77

100.80


2 The Above unaudited results have been prepared and presented as per Companies (Indian Accounting Standards) Rules, 2015 as amended ("Ind AS") prescribed under section 133 of the Companies Act, 2013 and in terms of Regulations 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (the "Listing Regulations"), as modified by Circular dated August, 10, 2016

The above is an extract of the detailed format of Financial Results for the quarter and nine months ended on December 31, 2024 filed with the Stock exchanges as per SEBI (Listing Obligations and Disclosure Requirement) Regulations, 2015. The full format of standalone financia results are available on the website of BSE at www.bseindia.com and on company's website www.gujaratterce.in. The same can be accessed by scanning Quick Response Code provided below. By and order of the Board of Director

Place : Ahmedabad Date : 04.02.2025



For Gujarat Terce Laboratories Limited Sd/-Aalap Prajapati (Managing Director and CEO) DIN: 08088327



SPRIGHT AGRO LIMITED (Formerly Known as Tine Agro Limited)

CIN NO. L01100GJ1994PLC117990

Reg. Office: Office No. 1216, Shilp Epitom, Rajpath - Rangoli Road, Off Sindhu Bhavan Road, Bodakdev, Ahmedabad, Gujarat, India, 380054 Website: www.sprightagro.com • Email Id: kansalfiberItd@gmail.com • Contact No: +91 7600916324

STATEMENT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 31ST DECEMBER, 2024

Based on the recommendations of the Audit Committee the Board of Directors at their respective Meetings held on 5th February, 2025. has approved the standalone unaudited financial results for the quarter ended 31st December, 2024 along with Limited Review Report as required under Regulation 33 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. The result is also available on the websites of the Stock Exchange(s) and the listed entity at https://sprightagro.com/financial-result/



Scan the QR code to view the Financial results on the website of the company

Place: Ahmedabad Date : 05/02/2025

For and on behalf of SPRIGHT AGRO LIMITED, Sd/- Akshaykumar Patel, Managing Director - (DIN: 08067509)

GUJRAT ENERGY TRANSMISSION CORPORATION SARDAR PATEL VIDYUT BHAVAN **RACE COURSE, HEAD OFFICE** BARODA - 390007.

PUBLIC NOTICE

GUJARAT ENERGY TRANSMISSION CORPORATION (GETCO) is a state Transmission Utility U/S - 39 of the Electricity Act, 2003 (hereinafter referred as the Act), as declared by Government of Gujarat vide Notification No. GHU-2004-31-GEB-1104-2946-K, dated 29.05.04. It being so declared, Government of Gujarat in exercise of the powers U/S - 164 of the Act, is further pleased to issue Notification No. GU-2007-5-ELA-1106-4884-K, dated 05.01.2007, conferring powers of Telegraphic Authority, under Indian Telegraph Act 1885, to GETCO and its Officers for laying Electricity lines and erection Towers for supply and transmission of electricity in the State of Gujarat as deemed necessary subject to the conditions prescribed under the said Notification. Through this public notice, it is hereby informed to the public that, in the public interest GETCO has decided, to install/lay Electricity Lines/towers, etc, for transmission of Electricity as under:

Sr. No	Name & Brief particulars of the scheme	Area of work	Estimated Capital cost (Rs. in lacs)
1	Erection of 66KV S/C line from 66KV Chhatral GIDC SS to proposed 66KV GIDC-III SS with 630sq.mm.(3+1) UG cable having length of 1.12RKM.	Area around and between Village: -	174.07

Through this public notice, GETCO hereby intends to get co-operation during laying transmission line. GETCO shall make provisions to give reasonable compensation towards loss or damage occurred to the standing crops/trees, as per the Act.

> Superintending Engineer(TR), GETCO, CO, Mehsana

D HDFC BANK

એચડીએફસી બેંક લિમિટેડ શાખા : એચડીએફસી હાઉસ, મીઠાકળી સિક્સ લેન રોડ પાસે, નવરંગપુરા,

અમદાવાદ-૩૮૦૦૦૯. ટેલ: ૦૭૯-૨૬૫૬૩૩૭૯

પઝેશન નોટિસ

We understand your world

જ્યારે એચડીએફસી બેંક લિમિટેડના ઓથોરાઇઝ્ડ ઓફિસર (અગાઉની એચડીએફસી લિમિટેડે ૧૭ માર્ચ, ૨૦૨૩ ના રોજના આદેશ દ્વારા માનનીય એનસીએલટી - મુંબઇ દ્વારા મંજર કરાયેલ જોડાણની યોજનાના આધારે એચડીએફસી બેંક લિમિટેડ સાથે જોડાણ કર્યું હતું) (એચડીએફસી), સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ ("કથિત એક્ટ") હેઠળ અને કલમ ૧૩(૧૨) હેઠળ પ્રદાન કરવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને સુરક્ષા હિત (અમલીકરણ) નિયમો ૨૦૦૨ ના નિયમ ૩ સાથે વાંચવામાં આવે છે, જેણે ઉપરોક્ત કાયદાની કલમ ૧૩ (૨) હેઠળ ડિમાન્ડ નોટિસ જારી કરી હતી, જેમાં નીચેના ઋણલેનાર (ઓ) / કાનૂની વારસદારો અને કાનૂની પ્રતિનિધિઓ (ઓ) ને તેમના નામ સામે ઉલ્લેખિત રકમની ચૂકવણી કરવા માટે કહેવામાં આવ્યું હતું. ઉપરોક્ત નોટિસોમાં ઉલ્લેખ કર્યા મુજબના દરો, ઉપરોક્ત નોટિસ/ની તારીખથી ૬૦ દિવસની અંદર, આકસ્મિક ખર્ચ, ખર્ચ, ચાર્જિસ વગેરે ચુકવણીની તારીખ અને / અથવા અનુભૂતિની તારીખ સુધી.

ક્રમ ન.	ઋણલેનાર (ઓ) / કાનૂની વારસદારો અને કાનૂની પ્રતિનિધિઓનું નામ	બાકી લેણાં	ડિમાન્ડ નોટિસ તારીખ	કબજાની તારીખ	સ્થાવર મિલકત(ઓ) / સિક્યોર્ડ એસેટ(ઓ) નું વર્ણન
એ	બી	સી	ડી	ຢ	એફ
1	શ્રી સોલંકી નિલેશભાઈ ગંગારામભાઈ (ઋણલેનાર) શ્રીમતી સોલંકી નલિનીબેન નિલેશભાઈ (સહ-ઋણલેનાર)	૩૦.૦૪.૨૦૨૪ ના રોજ રૂ. ૬,૧૬,૫૪૭/-, રૂ. ૫,૫૯,૦૧૩/- અને રૂ. ૨૧,૫૪૯/- બાકી	०७.०६.२०२४	૦૨.૦૨.૨૦૨૫ (ફિઝિકલ પઝેશન)	યુનિટ - ૨૧/ઈ, સહજાનંદ રેસિડેન્સી ૨, એસ નં. ૪૧, એફપી : ૯૧, ટી.પી: ૦૧, એસ.એમ.પટેલ સ્કૂલ પાસે, બાવળા- અમદાવાદ, અમદાવાદ: ૩૮૦૦૧૫
2	શ્રી વાઘેલા હિતેન્દ્રસિંહ (ઋણલેનાર)	૩૧.૦૫.૨૦૨૪ ના રોજ રૂ. ૧૦,૧૦,૭૦૯/- અને રૂ. ૩૦,૧૨૧/- બાકી	२९.०६.२०२४	૦૨.૦૨.૨૦૨૫ (ફિઝિકલ પઝેશન)	ફ્લેટ નં. એ/૧૦૧, પહેલો માળ, સહજાનંદ રેસિડેન્સી III, આર એસ ૩૨/૩, એફ પી ૯૮, ટી પી એસ ૦૧, સહજાનંદ ૨ ની સામે, ગર્લ્સ સ્કૂલ રોડ, બાવળા અમદાવાદ- ૩૮૨૨૨૦

*લાગુ પડતું હોય તે રીતે વધુ વ્યાજ સાથે, આકસ્મિક ખર્ચ, ખર્ચ, ચાર્જ વગેરે ચૂકવણીની તારીખ અને/અથવા પ્રાપ્તિની તારીખ સધી

જો કે, અહીં ઉલ્લેખિત ઋણલેનાર/કાનૂની વારસદારો અને કાનૂની પ્રતિનિધિઓ(ઓ) બાકી નીકળતી રકમની ચુકવણી કરવામાં નિષ્કૃળ ગયા હોવાથી, અહીં ઉલ્લેખિત ઋણલેનાર/કાનૂની વારસદારો અને કાનૂની પ્રતિનિધિઓ(ઓ) અને કાનૂની પ્રતિનિધિઓને અને સામાન્ય રીતે જનતાને નોટિસ આપવામાં આવે છે કે એચડીએફસીના અધિકૃત અધિકારી/ઓ એ કલમ ૧૩(૪) હેઠળ તેમને આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને ઉપર જણાવેલ સ્થાવર મિલકત (ઓ) / સુરક્ષિત સંપત્તિ (ઓ) નો ભૌતિક કબજો લીધો છે. ઉપરોક્ત અધિનિયમની ઉપર જણાવેલ તારીખો પરના ઉપરોક્ત નિયમોના નિયમ ૮ સાથે વાંચવામાં આવે છે.

અહીં ઉલ્લેખિત ઋણલેનાર(ઓ) / કાનૂની વારસદારો અને કાનૂની પ્રતિનિધિઓ(ઓ) ખાસ કરીને અને સામાન્ય રીતે જાહેર જનતાને અહીંથી ઉપરોક્ત સ્થાવર મિલકત (ઓ) / સિક્યોર્ડ એસેટ્સ (ઓ) સાથે વ્યવહાર ન કરવા ચેતવણી આપવામાં આવે છે અને ઉપરોક્ત સ્થાવર મિલકત (ઓ) / સિક્યોર્ડ એસેટ્સ (ઓ) સાથેનો કોઈ પણ વ્યવહાર એચડીએફસીના મોર્ગેજને આધિન રહેશે. ઋણલેનાર(ઓ) / કાનૂની વારસદારો/કાનૂની પ્રતિનિધિ(ઓ) ધ્યાન સુરક્ષિત સંપત્તિ/ઓ ને રિડીમ કરવા માટે ઉપલબ્ધ સમયના સંદર્ભમાં કાયદાની કલમ ૧૩ ની પેટા-કલમ (૮) ની જોગવાઈઓ પર આમંત્રિત કરવામાં આવે છે.

પંચનામાની નકલો દોરવામાં આવી હોય અને માલ સુચિ કરવામાં આવેલ હોય તે અન્ડરસહી કરેલ વ્યક્તિ પાસે ઉપલબ્ધ હોય છે, અને ઉક્ત ઋણલેનાર(ઓ) / કાનૂની વારસદાર(ઓ) / કાનૂની પ્રતિનિધિ (ઓ) ને ઓફિસના સામાન્ય કલાકો દરમિયાન કોઈ પણ કામકાજના દિવસે નીચે સહી કરાયેલ પાસેથી સંબંધિત નકલ એકત્રિત કરવા વિનંતી કરવામાં આવે છે.

તારીખ: ૦૫.૦૨.૨૦૨૫ સ્થળ : અમદાવાદ

એચડીએફસી બેંક લિ મહી/ અધિકત અધિકારી

રજિસ્ટર્ડ ઓફિસ: એચડીએફસી બેંક લિમિટેડ, એચડીએફસી બેંક હાઉસ, સેનાપતિ બાપટ માર્ગ, લોઅર પરેલ (વેસ્ટ). મુંબઈ-૪૦૦૦૧૩. CIN: L65920MH1994PLC080618 વેબસાઇટ: www.hdfcbank.com

Revenue from operations	242	1,088	247	824	Revenue	
EBITDA (Excluding Other Income, Exceptional Items and Foreign Exchange & MTM Loss)	35	211	42	113	+32%	
Profit before Exceptional items and Tax	28	216	50	125		
Exceptional items (Refer note no. 2)	46	46	-	2		
Profit/(Loss) after Exceptional items and before Tax	(18)	170	50	123		
Net Profit/(Loss) after Tax for the period/year	(10)	134	41	100		
Total Comprehensive Income for the period/year [Comprising Profit for the period/year (after tax) and Other Comprehensive Income (after tax)]		135	41	100		
Paid-up Equity Share Capital (Face Value ₹ 2/- per share)	14	14	14	14	PAT	
Earnings Per Share (of ₹ 2/- each)*					+34%	
Basic & Diluted (₹)	(1.37)	19.50	5.91	14.41		
* EPS is not annualised for the quarter/nine months ended December 31, 2024 and December 31, 2023.						

NOTES:

1. Key numbers of Standalone Results are as under:				(₹ in Crores)	
	Quarter Ended	Nine Months Ended	Quarter Ended	Nine Months Ended	Standalone 9M YoY
Particulars	31-Dec-24	31-Dec-24	31-Dec-23	31-Dec-23	Growth (%)
	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	
Revenue from operations	182	814	177	545	Revenue
EBITDA (Excluding Other Income, Exceptional Items and Foreign Exchange & MTM Loss)	34	188	41	98	+49%
Profit before exceptional items and tax	39	220	52	134	
Exceptional items (Refer note no. 3)	46	46	-	-	
Profit/(Loss) after Exceptional items and before Tax	(7)	174	52	134	
Net Profit/(Loss) after Tax for the period/year	(4)	132	43	107	

2. During the quarter ended December 31, 2024, the Parent Company has made a provision for doubtful debts amounting to ₹ 45.99 crores classified, as an exceptional item. This provision is in addition to the provisions made in earlier periods and pertains to receivables from M/s Pathways Retail Pvt Ltd, Delhi (E-Com distributor). As on December 31, 2024, the entire outstanding amount from the said distributor has been provided for as doubtful debt by the Parent Company.

The Parent Company has initiated stringent legal actions under sections 336, 340, 316, 318, 61 & 54 of the Bharatiya Nyaya Sanhita Act, 2023, as well as under section 138 of the Negotiable Instruments Act, 1881, for the dishonouring of a cheque

Furthermore, the Parent Company has entered into a settlement agreement with the said distributor, executed to secure repayment in accordance with court proceedings. The Parent Company has created rights and interests over valuable immovable properties located in Gurugram and Delhi. The residual value of these properties is expected to adequately cover the outstanding dues.

3. The Board of Directors in their meeting held on February 05, 2025 declared 3rd interim dividend of ₹ 2/- (100%) per equity +23% share of ₹ 2/- each amounting to ₹ 13.73 crores. The record date for the payment of interim dividend is February 11, 2025.

4. The above is an extract of detailed format of quarterly/nine months ended Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015. The full format of the quarterly/nine months ended Financial Results are available on the Stock Exchange websites www.nseindia.com, www. bseindia.com and on Company's website www.symphonylimited.com. The same can be accessed by scanning the QR code provided below



Place : Ahmedabad

27°C world

Date : February 05, 2025

By Order Of The Board For Symphony Limited

Achal Bakeri **Chairman & Managing Director** DIN-00397573



PAT

Vorld Leader in Air Cooling Solutions for Residential, Commercial, and Industrial Spaces. Trusted in Over 60 Countries Worldwide. Now Offering Advanced Tower Fans and Gey Registered Office: Symphony Limited, Symphony House, FP-12 TP-50, Bodakdev, Off SG Highway, Ahmedabad 380059, Gujarat. India. CIN: L32201GJ1988PLC010331 | Web: www.symphonylimited.com | Email: corporate@symphonylimited.com | Phone: +91-79-66211111 | Fax: +91-79-6621139

Our Global Brands: MOVICOL DIETS" TOUCH CLOUD SILVER STOTE DIET ACOOL WINTER SUND JUNED DATE Archic Circle Master Cool. SPA SAUNA SOUL KI CELLAR BONAIRE